



જનસંપર્ક અધીકારી દ્વારા

પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર

ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩



કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૧૫/૦૫/૨૦૧૯ બુધવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગાર ધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૮૩૯/૧૯

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૫૯ કેસ કરી, ૫૦ વ્યક્તિઓને ઝડપી, ૩૭૩ લીટર દેશી દારૂ, ૧૪ બોટલ ઇંગ્લીશ દારૂ, ૦૬ ક્વોટર ઇંગ્લીશ દારૂ અને ૦૧ રીક્ષા કબજે કરી હતી. તેમજ જુગાર ધારા હેઠળ ૦૪ કેસ કરી ૧૬ વ્યક્તિઓને ઝડપી રોકડ રૂપિયા ૭,૮૦૦/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૮૪૦/૧૯

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલા હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૮૯ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પ્રોહી.૯૩ મુજબ ૦૨ વ્યક્તિઓની અટકાયત કરી હતી.

વિશ્વાસઘાત અને છેતરપીંડી :-

સમાચાર યાદી નં.૮૪૧/૧૯

બાપુનગર : સુરેશભાઈ ડાહ્યાભાઈ પટેલ (ઉ.વ.૪૫)(રહે. ગુ.હા.બોર્ડ, બાપુનગર) એ તા.૧૪/૦૫/૨૦૧૯ નારોજ બાપુનગર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે આશરે ચારેક વર્ષ પહેલા ફેબ્રુઆરી/૨૦૧૫ ના સમયગાળામાં મનહરનગર વિભાગ- ૨ ખોડિયારનગર ચાર રસ્તા નેશનલ હાઇવે નં.૮ સોના-રૂપાની દુકાન ખાતે સુરેશભાઈએ આરોપી પરેશભાઈ કીર્તીભાઈ શાહ (રહે.મનહરનગર વિભાગ- ૨ ખોડિયારનગર ચાર રસ્તા નેશનલ હાઇવે નં.૮ બાપુનગર) નાઓના કાકા પાસેથી અગાઉ હાથ ઉછીના લીધેલ કુલ રૂપિયા ૪,૦૦,૦૦૦/- તેના કાકાને પરત આપવા માટે પરેશભાઈને આપ્યા હતા. જે રૂપિયા તેના કાકાને પરત નહી આપી, સુરેશભાઈ સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી બી.ડી.રાઠોડ ચલાવે છે.

લુંટ :-

સમાચાર યાદી નં.૮૪૨/૧૯

સોલા હાઇકોર્ટ : ભાવનાબહેન વા/ઓ મનીષભાઈ પટેલ (ઉ.વ.૩૫)(રહે.હાઇકોર્ટ એમ્લોય સોસાયટી વસંતનગર ટાઉનશીપ, ગોતા) તા.૧૪/૦૫/૨૦૧૯ બપોરના ૦૩/૧૫ વાગ્યાના સુમારે ગોતા વસંતનગર ઓગણજ રોડ, વીર સાવરકર હાઇટસ-૩ ની સામે થી પસાર થઇ રહ્યા હતા દરમ્યાન એક મોટર સાયકલ ઉપર આવેલ બે પુરૂષ એ ભેગામળી ભાવનાબહેનના ગળામાંથી સોનાની ચેઇન કિંમત રૂપિયા ૧૭,૦૦૦/- મતાની ખેંચી તોડી લઇ નાસી ગયા છે. આ અંગેની ફરીયાદ ભાવનાબહેન પટેલ એ સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી એમ.જે.હુણ ચલાવે છે.

ધરફોડ ચોરી :-

સમાચાર યાદી નં.૮૪૩/૧૯

વસ્ત્રાપુર : યોગેશસિંગ જયસિંગ જાદન(રાજપુત)(ઉ.વ.૩૭)(રહે.સરદારનગર સાંઘબાબા મંદિર પાછળ ના મકાનમાં, સરદારનગર) એ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૧૩/૦૫/૨૦૧૯ રાતના ૧૧/૦૦ થી તા.૧૪/૫/૨૦૧૯ સવારના ૦૬/૦૦ વાગ્યા દરમ્યાન વસ્ત્રાપુર લેક ગાર્ડન માં આવેલ અમુલ પાર્લરના શટર નું લોક તોડી, અજાણી વ્યક્તિ પાર્લરમાં પ્રવેશ કરી, કેશ કાઉન્ટરમાંથી રોકડ રૂપિયા ૮૦,૦૦૦/- ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી જી.આર.ભરવાડ ચલાવે છે.

સરદારનગર : અશોકભાઈ દશરથલાલ શાહ (ઉ.વ.૫૯)(રહે,ઈન્દ્રલોસ સોસાયટી આઈ.ટી.આઈ. કુબેરનગર સરદારનગર) એ તા.૧૪/૫/૧૯ ના રોજ સરદારનગર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૦૯/૦૫/૧૯ ના ૧/૦૦ થી કલાક ૩/૩૦ વાગ્યા દરમ્યાન કોઈપણ સમયે પોતાના મકાનના ઘાબાની સીડી થી કોઈ અજાણી વ્યક્તિ નીચે ઉતરી રૂમમાં પ્રવેશ કરી, રૂમમાંથી (૧) ડાયમંડની વીટી કિંમત રૂપિયા ૨૦,૦૦૦/- (૨) સોનાનું પેન્ડલ કિંમત રૂપિયા ૨૫,૦૦૦/- (૩)ચાંદીના સાંકળા કિંમત રૂપિયા ૨,૦૦૦/- તથા પર્સમાં મુકેલ રોકડ રૂપિયા ૭૦,૦૦૦/- તથા થાઇલેન્ડની કરન્સી જે ૨૦૦૦ ની હતી જે ભારતીય રૂપિયા લેખે ૫,૦૦૦/- ગણી શકાય તથા એક કેનોન કંપનીનો કેમેરો મળી કુલ રૂપિયા ૧,૨૨,૦૦૦/- મતાની ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી સી.વી.ગોસાઈ ચલાવે છે.

ચોરી :-

સમાચાર યાદી નં.૮૪૪/૧૯

વટવા : મહમદરફીક કાલુમીયા મલેક (ઉ.વ.૫૨)(રહે.ગોલ્ડન નાઇન જુના પોલીસ સ્ટેશનની પાસે વટવા) એ તા.૧૪/૦૫/૨૦૧૯ નારોજ વટવા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૧૨/૦૫/૧૯ બપોરના ૩/૦૦ થી ૪/૦૦ સુધીના સમયગાળા દરમ્યાન પોતાના ખુલ્લા ઘરમાં અજાણી વ્યક્તિ પ્રવેશ કરી, તેમની પુત્રવધુના સોનાના દાગીના તથા રોકડ રૂપિયા ૧૫,૦૦૦/- અને બે મોબાઈલ ફોન કિંમત રૂપિયા ૧૬,૦૦૦/- મળી કુલ રૂપિયા ૬૧,૦૦૦/- મતાની ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ મ.સ.ઈ.શ્રી અમૃતાબહેન યોગેશકુમાર ચલાવે છે.

અપમૃત્યુ :-

સમાચાર યાદી નં.૮૪૫/૧૯

નારોલ : નેત્રામ મલ્લારામ મીણા (ઉ.વ.૩૬)(રહે.શ્રી ગણેશ ગોડાઉનમાં, રાજધર્મ કાંટાની બાજુમાં, પીપળજ-પીરાણા રોડ, નારોલ) તા.૧૩/૦૫/૧૯ સવારના ૬/૦૦ વાગ્યાના સુમારે નારોલ પીપળજ-પીરાણા રોડ, ગણેશ ગોડાઉન ખાતે ટ્રકમાંથી માલ ખાલી કરવા માટે ટ્રક ઉપર ચડતો હતો તે દરમ્યાન ટ્રક ની ઉપરની ઍંગલ પકડવા જતા, હાથ લપસી જતા જમીન પર પડતા માથાના અને કપાળના ભાગે પથ્થર વાગતા ઇજા થતા સારવાર માટે તેમને સીવીલ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા જ્યાં સારવાર દરમ્યાન તા.૧૪/૦૫/૨૦૧૯ ના કલાક ૭/૩૦ વાગે ફરજ પરના ડૉ.શ્રીએ તેમને મૃત જાહેર કર્યા હતા. આ અંગે નારોલ પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ હે.કો.શ્રી ઇન્તેખાબઆલમ મુખતારહસન ચલાવે છે.

આત્મહત્યા :-

સમાચાર યાદી નં.૮૪૬/૧૯

ગોમતીપુર : (૧) મયુર લલજીભાઈ જાદવ (ઉ.વ.૨૧)(રહે.બાઈમોતીની ચાલી ખાડાવાળી ચાલી ગોમતીપુર) એ અગમ્ય કારણસર તા.૧૪/૦૫/૧૯ ના કલાક ૦૨/૩૦ વાગ્યા પહેલા કોઈપણ સમયે પોતાના ઘરે પંખા સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી છે. આ અંગે ગોમતીપુર પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ પો.સ.ઇ.શ્રી એસ.એમ.મેકવાન ચલાવે છે.

ગોમતીપુર : (૨) કોમલબહેન ડો/ઓ રમેશભાઈ ડાંગીયા(વાલ્મીકી)(ઉ.વ.૧૭)(રહે. મ્યુનિ હેલ્થ સ્ટાફ ક્વાર્ટસ રાયપુર ભજીયા હાઉસ પાછળ, સુખરામનગર ગોમતીપુર) એ અગમ્ય કારણસર તા.૧૪/૦૫/૧૯ સાંજના ૪/૦૦ વાગ્યાના સુમારે પોતાના ઘરે પંખા સાથે સાડી બાંધી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી છે. આ અંગે ગોમતીપુર પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ પો.સ.ઇ.શ્રી એસ.એમ.મેકવાન ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.
પોલીસ કમિશનર વતી.